

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટન મેળવે છે સીમાચિહ્નરૂપ ઇલેક્ટ્રિક બસ પાઈલટ પ્રોજેક્ટ માટે 11.15 મિલિયન ડોલરનું રોકાણ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (29 જુલાઈ 2019) – આજે મેયર પેટ્રિક બ્રાઉને (Mayor Patrick Brown) બ્રેમ્પટન સીટી કાઉન્સિલ વતી બ્રેમ્પટનમાં સીમાચિહ્નરૂપ ગણાતા પેન-કેનેડિયન ઇલેક્ટ્રિક બસ ડેમોન્સ્ટ્રેશન એન્ડ ઇન્ટિગ્રેશન ટ્રાયલમાં ગવર્નમેન્ટ ઓફ કેનેડાના નોંધપાત્ર નિવેશનું સ્વાગત કર્યું.

માનનીય કેથરિન મકકેના, પર્યાવરણ અને હવામાન પરિવર્તન મંત્રી દ્વારા પાઈલટ પ્રોજેક્ટના તબક્કા 1 માટે \$11.15 મિલિયનનું નીધિયન જાહેર કરવામાં આવ્યું જેમાં બ્રેમ્પટન ખાતે બેટરી ઇલેક્ટ્રિક બસોનું પરીક્ષણ થશે.

આવા પહેલી વખત હાથ ધરાતો પ્રોજેક્ટ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ને કેનેડિયન અર્બન ટ્રાન્ઝિટ રિસર્ચ એન્ડ ઇનોવેશન કન્સોર્ટિયમ (CUTRIC), સંપૂર્ણતઃ ઇલેક્ટ્રિક બસોનાં નિર્માતા ન્યુ ફ્લાયર ઇન્ડસ્ટ્રીઝ (New Flyer Industries) અને નોવા બસ તેમજ ચાર્જિંગ સ્ટેશન ઉત્પાદકો ABB અને સિમેન્સના સહયોગથી પરિણમ્યો છે. આવી અભૂતપૂર્વ પહેલથી બ્રેમ્પટનમાં ઇલેક્ટ્રિક બસો અમલમાં મુકવા માટે સરકાર, બસ અને ચાર્જર ઉત્પાદકો, સિસ્ટમ ઇન્ટિગ્રેટર્સ શિક્ષણવિદો અને નીધિયન ભાગીદારોનાં બહુવિધ સ્તરો એકજૂટ થયા છે.

આમાં માનકીકૃત અને સંપૂર્ણપણે આંતરપ્રચાલિત વિદ્યુત બસો તેમજ ઉચ્ચ વિદ્યુત પ્રવાહ સંચાલિત ઓવરહેડ ઓનરૂટ ચાર્જિંગ સિસ્ટમ સૌથી વિશાળ એકમાત્ર વ્યૂહરચના હશે; જેની સાથે હશે આઠ ઇલેક્ટ્રિક બસો (છ ન્યુ ફ્લાયર ઇન્ડસ્ટ્રીઝની અને બે નોવા બસની) અને ચાર ચાર્જિંગ સિસ્ટમ્સ (ABBગૂપની ત્રણ અને એક સિમેન્સની) હશે.

સફળતાને વરેલી ટેઈલપાઈલ એમિશન રહિત બેટરી ઇલેક્ટ્રિક બસોનો પ્રારંભ બ્રેમ્પટનનાં બે સ્થાપિત પ્રાણાલીગત રૂટ્સ પર થશે: રૂટ 23 સેન્ડલવૂડ અને રૂટ 26 માઉન્ટ પ્લેઝન્ટ. નવા ઓન-રૂટ ચાર્જિંગ સ્ટેશનોનો પ્રારંભ માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ ટર્મિનલ, કિવન સ્ટ્રીટ/હાઈવે 50 ઝૂમ સ્ટેશન અને સેન્ડલવૂડ ટ્રાન્ઝિટ ફેસિલિટી પર થશે. સમગ્ર પ્રોજેક્ટની કિંમત અંદાજે \$15.96 મિલિયન થશે.

ઇલેક્ટ્રિક બસોનું આગમન બ્રેમ્પટનનાં માર્ગો પર 2020ના ઉત્તરાર્ધ/2021નાં પૂર્વાર્ધમાં થશે.

ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સેવા જે સીટીની એકંદર કાર્બન ફુટપ્રિન્ટ અને ગ્રીનહાઉસ ગેસ એમિશન્સ (GHG) ઘટાડતી હોય તે પૂરું પાડવા માટે નવા અને પ્રવર્તનાત્મક ઉકેલો આપવા માટે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પ્રતિબદ્ધ છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ હાલમાં તેમની ફ્લીટમાં 121 ડિઝલ-ઇલેક્ટ્રિક હાયબ્રિડ ઝૂમ બસ રેપિડ ટ્રાન્ઝિટ બસો સહિત 441 બસ ચલાવે છે.

### અવતરણો

"એક ચિત રીતે જોડાયેલ ટ્રાન્ઝિટ નેટવર્ક કેનેડાનાં ઇનોવેશન કોરિડોરમાં આપણો દરજ્જો બનાવવા માટે અતિ મહત્વપૂર્ણ છે. આજની જાહેરાત કોરિડોરમાં વધારાના બ્રેમ્પટન ઇનોવેશન લાવશે અને બ્રેમ્પટનને ટકાઉ પરિવહનનાં ક્ષેત્રે અધિષ્ઠાતાનો દરજ્જો અપાવશે. નવી ઇ-બસો આપણી કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવા અને એક ગ્રીન સીટીનાં નિર્માણમાં રહેલ કાઉન્સિલની પ્રતિબદ્ધતાનો પુરાવો છે."

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

"બ્રમ્પટન સીટી કાઉન્સિલ હવામાન કટોકટી જાહેર કરવામાં 35 અન્ય નગરપાલિકાઓ સાથે જોડાઈ છે. બ્રમ્પટનમાં ઉત્પન્ન થતા ગ્રીનહાઉસ ગેસના એમિશનોને 80 ટકા જેટલા ઘટાડવાના આપણા પ્રવાસમાં ઈ-બસ લોન્ચ એક વિશાળ સીમાચિહ્ન ગણાશે. અમે રોમાંચિત છીએ અને આ સાહસમાં રહેલ અમારા તમામ ભાગીદારોનો આભાર માનીએ છીએ."

- કાઉન્સિલર રોવેના સાન્તોસ, પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ

"બ્રમ્પટન ટ્રાન્ઝિટ દ્વારા વિતેલા ઘણાં વર્ષો દરમિયાન અનેક નવી ટેકનોલોજિઓ તેમજ પહેલો રજૂ કરવામાં આવી છે જેથી આપણા ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવા આપી શકાય. આ એવો પરોજેક્ટ છે જેમાં અમે નવી, ઈનોવેટિવ ટેકનોલોજિઓ તપાસી રહ્યા છીએ. આ વિશ્વ સ્તરે પ્રથમ વખત થનાર પરિયોજનાને આગળ ધપતી જોઈ અમને ગૌરવ અને રોમાંચની લાગણી થાય છે."

- એલેક્સ મિલોજેવિક, જનરલ મેનેજર, બ્રમ્પટન ટ્રાન્ઝિટ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક:**

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)